

NOTICE

Pursuant to Regulation 29 read with regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015, as amended, Notice is hereby given that the meeting of the Board of Directors of the Company which was scheduled to be held on Wednesday, the 19th May, 2021, shall now be held on **Thursday, the 27th May, 2021** due to COVID related challenges, inter-alia, for consideration and approval of the Audited Financial Results (Standalone & Consolidated) of the Company for the quarter / year ended 31st March, 2021 and to recommend dividend on the equity shares of the Company for the year ended 31st March, 2021, if any.

The intimation contained in this notice is available on the Company's website at www.punjabchemicals.com and also on the website of BSE Ltd. (www.bseindia.com) and the National Stock Exchange of India Ltd. (www.nseindia.com).

For PUNJAB CHEMICALS & CROP PROTECTION LTD.
Sd/-
PUNIT K ABROL
SR. V.P. (FINANCE) & SECRETARY

Date: May 12, 2021

Place: Derabassi

नलको NALCO
(A Government of India Enterprise)
Bhubaneswar-751013, Odisha, India
CIN : L27203OR1981GOI000920

GLOBAL INVITATION Bidders Registration for Alumina & Aluminium
Ref: NALCOMKTG/EXPPR/038 Date: 19/04/2021
NALCO is a leading producer and exporter of LME registered Primary Aluminium Metal and Metallurgical Grade Calcined Alumina. The company exports around 1,25,000 MT of Aluminium metal and 12,00,000 MT of Metallurgical Grade Alumina per annum which are accepted worldwide.

Reputed overseas buyers interested in registering with NALCO for participating in export tenders for these products are requested to visit NALCO's website www.nalcoindia.com for details. The registration of such prospective buyers is an ongoing process.

Executive Director
(Commercial-Mktg)

APM TERMINALS Lifting Global Trade.

Gujarat Pipavav Port Limited

Regd. Office: Pipavav Port, At Post Rampara-2 via Rajula
Dist. Amreli Gujarat-365560

CIN: L63010GJ1992PLC018106 Tel: 02794 242400 Fax: 02794 242413

Website: www.pipavav.com Email: investorrelationnppv@apmterminals.com

Pursuant to Regulation 29 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 Notice is hereby given that a Meeting of the Board of Directors of Gujarat Pipavav Port Limited ('the Company') will be held on Thursday 27th May 2021, inter-alia, to consider Audited Standalone and Consolidated financial results for the year ended 31st March 2021 and Recommend Final Dividend on the Equity Share Capital for the year ended 31st March 2021, for approval by the Members of the Company at its Annual General Meeting.

The details of the meeting are also available on the Company website www.pipavav.com and on the website of the Stock Exchanges www.bseindia.com and www.nseindia.com

For Gujarat Pipavav Port Limited

Manish Agnihotri
Company Secretary

Date : 12th May 2021

Place: Mumbai

EVEREADY INDUSTRIES INDIA LTD.

CIN: L31402WB1934PLC007993
Registered Office: 1, Middleton Street, Kolkata-700071
Phone: 033-2288-3950, 2288-2147; Fax: 033-2288-4059; Email: investorrelation@eveready.co.in; Website: www.evereadyindia.com

NOTICE

Transfer of Equity Shares of the Company to the Investor Education and Protection Fund
NOTICE is hereby given that the Company will be transferring all those equity shares on which dividends have remained unclaimed for 7 (seven) consecutive years to the Demat Account of the Investor Education and Protection Fund Authority (IEPF Authority), pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 and the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended by Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Amendment Rules, 2017 ("the Rules").

In terms of the various requirements set out in the Rules, the Company has communicated to the concerned shareholders individually, at their latest available registered addresses, who have not claimed their dividends for last seven consecutive years i.e., for the Financial Year 2013-14 and onwards and whose share(s) are liable to be transferred to the Demat Account of the IEPF Authority under the said Rules. The last date for claiming of unclaimed dividend for the financial year 2013-14 is August 30, 2021 and the shareholders have been requested to claim the said unclaimed dividend for the financial year 2013-14 before August 14, 2021.

The Company has also updated the details of such shareholders along with their folio number or DP ID/ Client ID and the number of shares due for transfer to Demat Account of the IEPF Authority on its website at www.evereadyindia.com/investor-relations/iepf.aspx to verify the details of dividends not cashed and the shares liable to be transferred to the Demat Account of the IEPF Authority. The shares liable to be transferred to IEPF Demat Account shall be transferred by following the procedure contained in the Rules which is as under:

i) In case of shares held in physical form - by issuance of duplicate share certificates and thereafter transferring the same to IEPF Demat Account. Accordingly, the original share certificate(s) held by you shall automatically stand cancelled.

ii) In case of shares held in demat mode - by transfer of shares directly to IEPF Demat Account through the depository participants as per Rules.

Both the unclaimed dividend and corresponding shares transferred to the IEPF Demat Account can be claimed back from IEPF Authority after following the procedure prescribed in the Rules. No claim shall lie against the Company in respect of unclaimed dividend amount and the shares transferred to IEPF Demat Account pursuant to the Rules.

The shareholders may please note that the details uploaded by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of the duplicate share certificate(s) by the Company for the purpose of transfer of physical shares to Demat Account of the Authority. In respect of shares held in Demat form, requisite corporate action shall be taken. In case the shareholders have any queries/difficulties on the subject matter and the Rules, they may contact the Company at its Registered Office or its Registrar and Transfer Agent, M/s Maheshwari Datamatics Pvt. Ltd., at 23 R. N. Mukherjee Road, 5th Floor, Kolkata-700001. Tel: +91 33 2248 2248 / 2243 5029; Fax: +91 33 2248 4787; E-mail: mdplc@yahoo.com.
For Eveready Industries India Ltd.
Sd/-
Kolkata Tehnaz Purwani
Date: May 12, 2021 Vice President - Legal & Company Secretary

Godrej Industries Limited
CIN: L24241MH1988PLC097781
Registered Office: Godrej One, Piroshanagar, Eastern Express Highway, Vikhroli (East), Mumbai - 400079, Maharashtra
Tel.: 022 - 2518 8010 Fax: 022 - 25188066
Email id: investor@godrejind.com
Website: www.godrejindustries.com

NOTICE
Pursuant to Regulations 29 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, NOTICE IS HEREBY GIVEN THAT a Meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday, May 21, 2021, *inter alia*, consider and approve the Standalone and Consolidated Audited Financial Results of the Company for the Quarter and Financial Year ended March 31, 2021, after these results are reviewed by the Audit Committee.

This notice is also made available on the website of the Company (www.godrejindustries.com) and on the websites of BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com).

For Godrej Industries Limited
Sd/-
Tejal Jariwala
Company Secretary & Compliance Officer
Place : Mumbai Date : 13.05.2021 (FCS 9817)

ALAMELU CHARITABLE FOUNDATION
Notice Inviting Tender
Alamelu Charitable Foundation (ACF) invites bids from eligible bidders for the Tender for Supply, Installation and Commissioning of the following Equipment/ Goods from Manufacturers / Authorized Vendors for its Hospitals spread across India:
Tender No 1 and 2: AC/FCI/CSSD-2/2021 and AC/FCI/Radiology-3/2021
Last Date of Submission: 31/05/2021 by 10 PM Item(s)/Service(s): CSSD Items and Ultra Sound Machines.
Tender No 3, 4, 5, 6 and 7: AC/FCI/SERVICES/SHK-1/2021, AC/FCI/SERVICES/Security 1/2021, AC/FCI/SERVICES/MANPOWER-1/2021, AC/FCI/Lab-01/2021 and AC/FCI/Supply/Uniform-01/2021
Last Date of Submission: 06/06/2021 by 10 PM Item(s) / Service(s): Housekeeping Services, Security Services, Man-Power Services, Lab Equipment and Uniform for Hospitals.
Tender No 8, 9, 10 and 11: AC/FCI/SME-3/2021, AC/FCI/Landscaping/2021, AC/FCI/Horticulture/2021 and AC/FCI/BB-2/2021.
Last Date of Submission: 01/06/2021 by 10 PM Item(s)/Service(s): Small Medical Equipment, Landscape Works, Horticulture Works and Blood Bank Equipment.
Interested parties may download Tender document from e-tender portal <https://acf.procure247.com> and submit online bids by following the prescribed process.
Sd/-, Director, Alamelu Charitable Foundation, Mumbai - 400005

VIKRAMIAN
advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

LENDINGKART
Think Cash. Think Lendingkart Group
LENDINGKART FINANCE LIMITED
CIN: U65910MH1996PLC258722

Registered Office: A-303/304, Citi Point, Andheri-Kurla Road, Andheri East, Mumbai, Maharashtra, 400 059, India
Corporate Office: B Block, 6th Floor, 'The First', Behind Keshavbaug Party Plot, Vastrapur, Ahmedabad-380 015, Gujarat, India.
Phone: +91-79-6814 4500 | Email: lendingkartfinance@lendingkart.com | website: <https://lendingkartfinance.com>

EXTRACT OF FINANCIAL RESULTS FOR THE SIX MONTHS AND FINANCIAL YEAR ENDED MARCH 31, 2021
(Amount: INR in Lakhs)

Sr. No.	Particulars	Half year ended March 31, 2021	Half year ended March 31, 2020	Year ended March 31, 2021	Year ended March 31, 2020
1.	Total Income from Operations	22,972.51	25,189.51	48,351.52	45,989.72
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	(451.09)	2,464.77	2,815.80	4,194.28
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	(451.09)	2,464.77	2,815.80	4,194.28
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	(333.03)	1,743.25	1,831.94	2,969.09
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(311.47)	1,739.44	1,879.99	2,965.28
6.	Paid up Equity Share Capital	4,418.79	4,418.79	4,418.79	4,418.79
7.	Reserves (excluding Revaluation Reserve)	69,742.58	67,868.46	69,742.58	67,868.46
8.	Net worth	74,161.37	72,287.25	74,161.37	72,287.25
9.	Paid up Debt Capital / Outstanding Debt	1,63,172.33	1,57,497.05	1,63,172.33	1,57,497.05
10.	Outstanding Redeemable Preference Shares	NIL	NIL	NIL	NIL
11.	Debt Equity Ratio	2.20	2.18	2.20	2.18
12.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - Basic and Diluted EPS is not annualised for half year ended March 31, 2021 and March 31, 2020	(0.75)	4.16	4.15	7.09
13.	Capital Redemption Reserve	NIL	NIL	NIL	NIL
14.	Debtenture Redemption Reserve	NIL	NIL	NIL	NIL
15.	Debt Service Coverage Ratio	0.11	0.11	0.22	0.20
16.	Interest Service Coverage Ratio	0.94	1.24	1.15	1.24

Notes:
a) The above is an extract of the detailed format of annual financial results filed with the Stock Exchange under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the annual financial results are available on the website of the Stock Exchange (<https://www.bseindia.com>) and on the Company's website (<https://lendingkartfinance.com>).
b) For the items referred in sub-clauses (a), (b), (d) and (e) of the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange (BSE Ltd) and can be accessed on the URL (<https://www.bseindia.com>).

On behalf of the Board of Directors of Lendingkart Finance Limited
Sd/-
Harshvardhan Lunia
Chairman & Managing Director
DIN No. 01189114

Place : Ahmedabad
Date : 12-05-2021

INDIA SHELTER FINANCE CORPORATION LIMITED
CIN: U65922HR1998PLC042782
Regd. Office: 6th Floor, Plot No.15, Institutional Area, Sector 44, Gurgaon, Haryana-122002

STATEMENT OF REVIEWED AUDITED FINANCIAL RESULTS FOR YEAR ENDED MARCH 31, 2021
[Regulation 52 (8), read with Regulation 52 (4), of the SEBI (LODR) Regulations, 2015]
(All amount in Rupees lakhs unless otherwise stated)

Sl. No.	Particulars	Six months ended 31 March 2021 (Unaudited)	Previous six months ended 31 March 2020 (Unaudited)	Year ended 31 March 2021 (Audited)	Year ended 31 March 2020 (Audited)
1.	Total Income from Operations	18,430.09	12682.12	31,670.61	22,908.06
2.	Other Income	485.31	75.49	609.22	82.98
3.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	7,778.76	3,119.80	11,295.69	6,383.88
4.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	7,778.76	3,119.80	11,295.69	6,383.88
5.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	5,995.95	2,462.20	8,738.86	4,691.14
6.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	5,974.78	2,458.56	8,717.62	4,690.99
7.	Paid up Equity Share Capital	4,297.84	4,283.02	4,297.84	4,283.02
8.	Reserves (excluding Revaluation Reserve)	-	-	-	-
9.	Net worth	89,429.12	80,545.35	89,429.12	80,545.35
10.	Paid up Debt Capital / Outstanding Debt	1,49,129.04	93,460.36	1,49,129.04	93,460.36
11.	Earnings Per Share (of Face Value Rs 10/- each) (for continuing and discontinued operations) * - • Basic: • Diluted:	13.98 13.62	5.81 5.71	20.39 19.86	10.99 10.80
12.	Debtenture Redemption Reserve	-	-	-	-
13.	Debt Equity Ratio	1.59	1.10	1.59	1.10
14.	Debt Service Coverage Ratio	0.41	0.54	0.52	0.69
15.	Interest Service Coverage Ratio	2.49	1.70	2.12	1.87

*EPS for six months not annualized.
Note:
a) The Company is a Housing Finance Company registered with National Housing Bank ("the NHB").
b) The above is an extract of the detailed format of condensed financial results for the half year ended as on March 31, 2021 filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the condensed financial results for the year ended as on March 31, 2021 is available on the website of the Stock Exchange, BSE (www.bseindia.com) and the website of the company (www.indiashelter.in) and at the registered office of the Company at India Shelter Finance Corporation Limited, 6th Floor, Plot No.15, Institutional Area, Sector 44, Gurgaon, Haryana-122002
c) **Disclosure in compliance with Regulation with Regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 for the year ended March 31, 2021.**
a) Credit rating of the company is A (Stable) as per rating certification dated November 24, 2020 and March 23, 2021 issued by ICRA and rating certification dated March 12, 2021 issued by CARE.
b) Asset Cover ratio: 1.10 times
c) Previous due date for the payment of interest on non-convertible debt securities is as below:

ISIN	Instrument	Principal	Interest	Payment Status
INE922K07013	NCD	Not yet due	10 October 2020	Paid
INE922K07047	NCD	Not yet due	31 October 2020	Paid
INE922K07013	NCD	10 November 2020	10 November 2020	Paid
INE922K07047*	NCD	10 November 2020	10 November 2020	Paid
INE922K07013*	NCD	8 December 2020	8 December 2020	Paid

*Re-purchased during the period of review.
d) Next due date for the payment of interest on non-convertible debentures is as below:

ISIN	Due Date
INE922K07039	Interest: May 02, 2025 Principal: May 02, 2025
INE922K07054	Interest: 12 June 2021 Principal: 12 June 2023

d) The financial results for the year ended as on March 31, 2021 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on May 11, 2021 and May 12, 2021 respectively.
e) The Company issued Secured Non-Convertible debentures of Rs. 15 crores during the year ended on 31 March, 2021
f) The debentures of the Company under ISIN INE922K07054 were listed on Bombay Stock Exchange (BSE) with effect from June 19, 2020.
g) The Company is engaged primarily in the business of financing and accordingly there are no separate reportable segments as per Ind AS 108 dealing with Operating Segment.

For INDIA SHELTER FINANCE CORPORATION LIMITED
Anil Mehta (MD & CEO)
Sd/-
Date: May 12, 2021
Place: Gurugram
DIN: 02132315

THERMAX LIMITED
Regd. Office: D-13, M.I.D.C Industrial Area, R.D. Aga Road, Chinchwad, Pune - 411 019
Phone: +91-20-66122100/66155000
Fax: +91-20-66122142 E-mail: cservice@thermaxglobal.com
CIN: L29299PN1980PLC022787

Notice To Shareholders

Transfer of Equity Shares of the Company to Investor Education and Protection Fund (IEPF)

Notice is hereby given pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013, read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the Rules") the dividend declared for the financial year 2013-14, which remained unclaimed for a period of seven years will be credited to the IEPF on August 28, 2021. The corresponding shares on which dividend was unclaimed for seven consecutive years will also be transferred as per the procedure set out in the Rules.

The Company will not transfer such shares to the IEPF where there is a specific order of Court/Tribunal restraining transfer of such shares or where the shares are hypothecated /pledged under the Depositories Act, 1996.

The Company has sent separate notices to the concerned shareholders whose shares are liable to be transferred to IEPF under the Rules for taking appropriate action. The details of the shareholders whose shares are liable to be transferred to IEPF are available on the Company's website <https://www.thermaxglobal.com/investor-relations/thermax-investor-education-protection-fund/>

Shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF, may note that the Company would be issuing duplicate share certificate(s) in lieu of the original held by them for the purpose of transfer of shares to IEPF and upon such issue, the Company shall inform the depository by way of corporate action to convert the duplicate share certificates into DEMAT form and transfer in favour of IEPF. The original share certificate(s) which are registered in the name of original shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Shareholders holding shares in dematerialized form and whose shares are liable to be transferred to IEPF, may note that the Company shall inform the depository by way of corporate action for transfer of shares in favour of the DEMAT account of the IEPF.

Shareholders may note that both the unclaimed dividend and the shares transferred to IEPF can be claimed from IEPF Authority after following the prescribed procedure under the Rules.

In case the Company does not receive any communication from the concerned shareholders by August 5, 2021, the Company shall transfer the unclaimed dividend and shares to the IEPF as per the Rules by due date i.e. August 28, 2021.

For any information / clarification on this matter, the shareholders may contact the Company's Registrar and Transfer Agents at **KFin Technologies Pvt. Ltd.**, Selenium Tower - B, Plot No. 31 & 32, Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500 032; Tel: 040-67162222 / 79611000; Fax: 040-23001153; Toll Free: 1800 309 4001; Email: einward.ris@kfinetech.com; Website: www.kfinetech.com

For Thermax Limited
Kedar P. Phadke
Company Secretary
FCS: 3349
Place: Pune
Date: May 12, 2021

Satin Housing Finance Ltd
CIN:U65929DL2017PLC316143, Corp Office: Plot No. 492, 2nd Floor, B-Wing, Udyog Vihar Phase-III, Gurugram, Haryana-122016
Regd Office: 5th Floor, Kundan Bhawan, Azadpur Commercial Complex, Azadpur, New Delhi-110033 Email ID: compliance@satinhousingfinance.com, Ph: 0124-4346200

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE YEAR ENDED MARCH 31, 2021

Sr. No.	Particulars	Rs. In Lakhs except EPS	
		Year ended 31, 2021	Previous year ended March 31, 2020
		Audited	Audited
1	"Total Income"	2,957.30	2,099.21
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	211.47	(123.93)
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	211.47	(123.93)
4	Net Profit / (Loss) for the period after tax (after Minority Interest, Exceptional and/or Extraordinary Items)	137.27	(94.53)
5	"Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax and Minority Interest) and Other Comprehensive Income (after tax))"	134.11	(91.71)
6	Paid up Equity Share Capital	9,500.00	8,000.00
7	Reserves (excluding Revaluation Reserve)	(175.57)	(289.69)
8	Net worth	9,324.43	7,710.31
9	Paid up Debt Capital / Outstanding Debt	13,942.74	9,990.46
10	Outstanding Redeemable Preference Shares	-	-
11	Debt Equity Ratio	1.50	1.30
12	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - 1. Basic: 2. Diluted:	0.16 0.16	(0.13) (0.13)
13	Capital Redemption Reserve	-	-
14	Debtenture Redemption Reserve	-	-
15	Debt Service Coverage Ratio	0.43	0.35
16	Interest Service Coverage Ratio	1.60	0.91

Notes: 1. The above is an extract of the detailed format of annual financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the annual financial results are available on the website of the Company (i.e. www.satinhousingfinance.com) and on the websites of the Stock Exchange (i.e. BSE - www.bseindia.com). 2. For the items referred in Regulation 52(4) of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the BSE and also made available on the website of the Company (i.e. www.satinhousingfinance.com). 3. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of Satin Housing Finance Limited ('the Company') at their meetings held on May 12, 2021

For Satin Housing Finance Limited
Sd/-
(Amit Sharma)
Whole Time Director & CEO
DIN No. 08050304
Place: Gurugram
Date: May 12, 2021

RP- Sanjiv Goenka Group
Growing Legacies

Firstsource Solutions Limited

Extract of the Consolidated Audited Financial Results for the quarter and year ended March 31, 2021
(₹ in millions, except per share data and per equity data)

Sl. No.	Particulars	Quarter ended			Year ended	
		March 31, 2021	December 31, 2020	March 31, 2020		

GOVERNMENT OF TAMIL NADU / WATER RESOURCES DEPARTMENT
Pennaiyar Basin Circle, Tiruvannamalai – 606 603.
FORM OF CONTRACT : LUMPSUM - ITEM RATE CONTRACT
TENDER NOTICE (TWO COVER SYSTEM)
SHORT TERM TENDER NOTICE NO.: 01/ PBC / T.V.Malai / 2021 – 2022 / F. 401/ JDO.1 / DATED: 28.05.2021 (Second Call)

For and on behalf of the Governor of Tamilnadu, the Superintending Engineer, WRD., Pennaiyar Basin Circle, Tiruvannamalai – 606 603, invites tender in Two cover system from eligible tenderers for the work of **"Reconstruction of low level causeway bridge into High Level Bridge across Kazhuvelli Lake in between Vannidipalayam Village and Urani Village in Marakkanam Taluk in Villupuram District."** (Value of work: Rs.714.00 Lakh including GST) at his office upto 03.00 p.m. on 10.06.2021 in sealed cover. The tender will be opened at 03.30 p.m. at his chamber on the same day.

Other information as details of Work, Value, EMD, Cost of tender schedule, Qualification details etc., will be available in the Government website www.tenders.tn.gov.in. Any Corrections or Modifications will be published on web site only.

DIPR/1644/Tender/2021 Superintending Engineer, (i/c) WRD., Pennaiyar Basin Circle, Tiruvannamalai – 3.

ASSAM CANCER CARE FOUNDATION
3rd floor, V.K. Trade Centre, G.S. Road, Opp. Downtown Hospital, Guwahati – 781022, Assam. Email: procurement@accf.in
Short Term Notice Inviting e-Tenders 29.5.2021

Assam Cancer Care Foundation (ACCF) invites bids/proposals for following goods/services from experienced OEMs/Agencies for hospitals of ACCF in the State of Assam:

- Supply, Installation and Commissioning of Laundry Equipment
- EOI for Empanelment of Vendors for supply of various Goods/services for ACCF Hospitals
- Rate Contract for Laptops

Details of EMD, bid schedule etc. are mentioned in the bid document. Bid documents for above tenders shall be uploaded within next 3-4 days. Interested OEMs/Agencies/Consultants may download & online submit the tender documents at www.accf.procure247.com. Bid document can also be downloaded from www.assamcancercarefoundation.org Chief Operating Officer, ACCF

Pipeline Infrastructure Limited
CIN: U63000MH2018PLC030292
Registered Office: Seawoods Grand Central, Tower-1, 3rd Level, C Wing - 301 to 304, Sector 40, Seawoods Railway Station, Navi Mumbai, Thane, Maharashtra - 400706, India; Tel No: +91 22 3501 8000; Email: compliance@pipelineinfra.com; Website: www.pipelineinfra.com

NOTICE TO DEBENTUREHOLDERS
RECORD DATE FOR PAYMENT OF INTEREST

Notice is hereby given that pursuant to the terms of 8.9508% Secured, Flated, Listed, Redeemable Non-convertible Debentures in the denomination of Rs. 10,00,000 each, issued by Pipeline Infrastructure Limited, on private placement basis and listed on the debt market segment of BSE Limited ("NCDs"), the Company has fixed 'Record Date' for determining the names of the NCD holders eligible to receive interest. The NCD holders whose names appear as Beneficial Owners on the Record Date as per the list furnished by the Depositories would be entitled to the said payment, as per the following details:

PURPOSE	RECORD DATE	DUE DATE FOR PAYMENT
Payment of Interest	Tuesday, June 15, 2021	Wednesday, June 30, 2021

For Pipeline Infrastructure Limited
Sd/-
Neha Jalan
Company Secretary
ACS 50594

Place: Mumbai
Date: May 28, 2021

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

APM TERMINALS Lifting Global Trade.
GUJARAT PIPAVAV PORT LIMITED
Registered Office : Pipavav Port, At Post Rampara-2, Tal. Rajula, Dist. Amreli, Gujarat 365560.
CIN: L63010GJ1992PLC018106 Tel: 02794 242400 Fax: 02794 242413 Website: www.pipavav.com Email: investorrelationppv@apmterminals.com

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31 MARCH 2021
(Amt in Rs Mn)

Particulars	STANDALONE				CONSOLIDATED		
	3 months ended	Preceding 3 months ended	Corresponding 3 months ended in the previous year	Year ended	Year ended	Year ended	Year ended
	31/03/2021 (Unaudited)	31/12/2020 (Unaudited)	31/03/2020 (Unaudited)	31/03/2021 (Audited)	31/03/2020 (Audited)	31/03/2021 (Audited)	31/03/2020 (Audited)
Total Income from Operations (Net)	1,934.27	1,984.00	1,619.42	7,334.63	7,334.63	7,334.63	7,353.69
Net Profit/(Loss) from Ordinary activities after Tax	653.75	543.27	472.45	2,180.77	2,911.32	2,216.45	3,181.25
Net Profit/(Loss) from Ordinary activities after Tax (after extraordinary items)	653.75	543.27	478.98	2,180.77	2,911.32	2,216.45	3,181.25
Paid-up equity share capital (Face value Rs. 10 per share)	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40	4,834.40
Other Equity as per the Balance Sheet of previous accounting year	--	--	--	15,487.59	16,014.08	--	18,048.19
Earnings per share (Before and after extraordinary items) (of Rs. 10 each) (not annualized)							
Basic:	1.35	1.12	0.99	4.52	6.05	4.59	6.61
Diluted:	1.35	1.12	0.99	4.52	6.05	4.59	6.61

Note: The above is an extract of the detailed format of Quarter/ Annual Financial Results filed with Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter/Annual Financial Results is available on the Stock Exchange websites (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website www.pipavav.com

For Gujarat Pipavav Port Limited
Jakob Friis Sorensen
Managing Director
DIN:08593830

Place: Mumbai
Date: 27th May 2021

RELIANCE **Reliance Infrastructure Limited**
Registered Office: Reliance Centre, Ground Floor, 19 Walchand Hirachand Marg, Ballard Estate, Mumbai 400 001. Website: www.rinfra.com; CIN: L75100MH1929PLC001530

I. Extract of the Consolidated Financial Results for the quarter and year ended March 31, 2021 (₹ crore)

Particulars	Quarter Ended		Year Ended	
	31-03-2021 (Unaudited)	31-12-2020 (Unaudited)	31-03-2020 (Audited)	31-03-2021 (Audited)
Total Income from Operations	4,742.99	4,983.91	4,524.52	19,145.81
Net Profit / (Loss) before Tax (before Exceptional items)	(64.87)	212.12	(30.19)	(437.77)
Net Profit / (Loss) before Tax (after Exceptional items)	(34.01)	307.60	(156.19)	(311.43)
Net Profit / (Loss) after Tax (after Exceptional items)	(46.53)	80.08	(153.84)	(532.30)
Total Comprehensive Income [Comprising Profit / (Loss) (after tax) and Other Comprehensive Income (after tax)]	(21.15)	431.55	(119.27)	(131.71)
Paid up Equity Share Capital (Face value of ₹ 10/- each)	263.03	263.03	263.03	263.03
Other Equity				8,939.86
Earnings Per Share of ₹ 10 each (not annualised for the quarter)				
Basic (₹)	(1.77)	3.04	(5.85)	(20.24)
Diluted (₹)	(1.77)	3.04	(5.85)	(20.24)

II. Extract from the Standalone Financial Results for the quarter and year ended March 31, 2021 (₹ crore)

Particulars	Quarter Ended		Year Ended	
	31-03-2021 (Unaudited)	31-12-2020 (Unaudited)	31-03-2020 (Audited)	31-03-2021 (Audited)
Total Operating Income	776.87	468.50	358.50	1,689.15
Net Profit / (Loss) before Tax (before Exceptional items)	(11.32)	(194.06)	5.79	(465.08)
Net Profit / (Loss) before Tax (after Exceptional items)	110.27	37.91	5.79	(111.52)
Net Profit / (Loss) after Tax (after Exceptional items)	127.97	60.01	30.31	(19.08)
Total Comprehensive Income	126.69	60.01	32.15	(18.87)

III. The above is an extract of the detailed format of financial results for the quarter and year ended March 31, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the said quarter and year ended are available on the websites of the Company, National Stock Exchange of India Limited and BSE Limited at www.rinfra.com, www.nseindia.com, and www.bseindia.com respectively.

Place: Mumbai
Date: May 28, 2021

SUDARSHAN
Sudarshan Chemical Industries Limited
Registered Office & Global Head Office : 162 Wellesley Road, Pune 411 001
Tel : 020 26226200 Fax : 020 26058222 CIN L24119PN1951PLC008409 Email : investorrelations@sudarshan.com Website : www.sudarshan.com

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & YEAR ENDED 31ST MARCH, 2021
(Rs. in Lakhs)

Sr. No.	Particulars	Standalone			
		Quarter Ended		Year Ended	
		31.03.2021 (Audited)	31.03.2020 (Audited)	31.03.2021 (Audited)	31.03.2020 (Audited)
1	Total income from continuing operations	51,954.0	36,529.1	1,70,850.1	1,51,826.8
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4,594.3	3,189.8	17,051.6	16,080.1
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	4,594.3	3,189.8	18,124.4	17,796.7
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	3,954.2	3,378.8	13,623.4	14,927.9
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	4,329.4	2,751.5	13,671.1	13,593.7
6	Paid-up equity share capital (Face Value Rs. 2/- per share)	1,384.5	1,384.5	1,384.5	1,384.5
7	Reserve excluding Revaluation Reserves as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	61,869.7
8	Earnings per share (of Rs. 2/- each)				
	Basic & Diluted				
	From Continuing Operations	5.7	4.9	19.7	21.6
	From Discontinued Operations	-	-	-	(0.1)
	From Total Operations	5.7	4.9	19.7	21.5
	Not annualised				

Sr. No.	Particulars	Consolidated			
		Quarter Ended		Year Ended	
		31.03.2021 (Audited)	31.03.2020 (Audited)	31.03.2021 (Audited)	31.03.2020 (Audited)
1	Total income from continuing operations	57,654.1	44,911.8	1,86,411.2	1,70,819.2
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	6,420.4	3,034.7	19,038.9	16,325.9
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	6,420.4	3,034.7	19,038.9	18,042.5
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	5,342.2	2,730.6	14,111.2	14,507.8
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5,577.2	2,190.9	14,153.1	13,505.2
6	Paid-up equity share capital (Face Value Rs. 2/- per share)	1,384.5	1,384.5	1,384.5	1,384.5
7	Reserve excluding Revaluation Reserves as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	58,694.1
8	Earnings per share (of Rs. 2/- each)				
	Basic & Diluted				
	From Continuing Operations	7.7	3.9	20.4	21.0
	From Discontinued Operations	-	-	-	(0.1)
	From Total Operations	7.7	3.9	20.4	20.9
	Not annualised				

NOTES :

- The above audited Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 28th May, 2021. These audited Financial Results have been prepared in accordance with the Indian Accounting Standards ("Ind-AS") as specified under Section 133 of the Companies Act, 2013 read with rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 (as amended from time to time) and the provisions of the Companies Act, 2013.
- The audited Consolidated Financial Results include the Financial Results of the wholly owned subsidiaries viz. RIECO Industries Limited, Sudarshan Europe B.V. (The Netherlands), Sudarshan (Shanghai) Trading Company Limited (China); Sudarshan Japan Limited and the step-down subsidiaries viz. Sudarshan North America Inc. (U.S.A.), and Sudarshan Mexico S de R.L. de CV (Mexico).
- The Board has recommended Final Dividend at Rs.6/- per share (300%) on the face value of Rs. 2/- per share for the Financial Year 2020-21 subject to the approval of the shareholders in the ensuing Annual General Meeting.
- The figures for the quarter ended 31st March, 2021 and the corresponding quarter ended in the previous year as reported in these Financial results are the balancing figures between audited figures in respect of the full financial year and the published year to date figures upto the end of the third quarter of the relevant financial year. Also the figures up to the end of the third quarter had only been reviewed and not subjected to audit.
- The above is an extract of the detailed format of Quarterly / Annual Financial Results as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The aforesaid Audited Financial Results will be uploaded on the Company's website www.sudarshan.com and will also be available on the websites of BSE Limited www.bseindia.com and The National Stock Exchange of India Limited www.nseindia.com for the benefit of shareholders and investors.

For and on behalf of the Board of Directors
R.B.RATHI
Managing Director

Place : Pune
Date : 28th May, 2021

Nippon Life India Asset Management Limited
(Formerly known as Reliance Nippon Life Asset Management Limited)
(CIN - L65910MH1995PLC220793)

Registered Office: 4th Floor, Tower A, Peninsula Business Park, Ganapatrao Kadam Marg, Lower Parel (W), Mumbai - 400 013. Tel No. +91 22 6808 7000 • Fax No. +91 22 6808 7097
Email: investorrelation@nipponindiaim.com • Website: <https://mf.nipponindiaim.com>

NOTICE OF 26TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 26th Annual General Meeting ("AGM") of the Members of Nippon Life India Asset Management Limited (Formerly known as Reliance Nippon Life Asset Management Limited) (the 'Company') is scheduled to be held on Tuesday, June 22, 2021 at 12:00 Noon IST through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice of the AGM only through e-voting facility. The Company has sent the Notice of AGM along with Annual Report for financial year 2020-21 on Friday, May 28, 2021, only through electronic mode to Members whose email addresses are registered with the Company / Depositories in accordance with Circular Nos. 14/2020, 17/2020, 20/2020 and 02/2021 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020 and January 13, 2021 respectively, issued by the Ministry of Corporate Affairs (collectively referred to as "MCA Circulars") and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated May 12, 2020 and January 15, 2021 issued by the Securities and Exchange Board of India (collectively referred to as "SEBI Circulars").

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 (the "Act") read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, from time to time and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations") and the Secretarial Standards on General Meetings ("SS2") issued by the Institute of Companies Secretaries of India, the Members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using electronic voting system (e-voting) provided by National Securities Depository Limited ("NSDL"). The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid up equity share capital of the Company as on Tuesday, June 15, 2021 ('Cut-off date').

The Company is providing remote e-voting facility ('remote e-voting') to all its members to cast their votes on all resolutions which is set out in the Notice of the AGM. Members have the option to cast their votes on any of the resolutions using the remote e-voting facility or e-voting during the AGM. Detailed procedure for remote e-voting / e-voting during the AGM is provided in the Notice of the AGM. The remote e-voting period commences on Friday, June 18, 2021 (9.00 a.m. IST) and ends on Monday, June 21, 2021 (5.00 p.m. IST). The remote e-voting module shall be disabled by the NSDL thereafter. The Members who have cast their votes by remote e-voting on the resolutions prior to the AGM may attend / participate in the AGM through VC / OAVM but shall not be entitled to cast their votes on such resolutions again.

Any person holding shares in physical form and non-individual shareholders, who acquires shares of the company and become a Member of the Company after sending of the Notice and holding shares as of the Cut-off date, may obtain the login ID and Password for casting his / her vote and for attending the AGM, by sending a request at evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote e-voting then he / she can use his / her existing user ID and password for casting the vote.

Individual Shareholders holding securities in electronic mode and who acquires shares of the Company and become a member of the Company after sending of the notice and holding shares as of the Cut-off date may follow steps mentioned in the Notice of the AGM.

The Board of Directors have appointed Mr. Mukesh Siroya, of M/s M Siroya & Co., Company Secretaries (Membership No. FCS 5682) as a Scrutiniser to scrutinise the voting process in a fair and transparent manner.

For details relating to remote e-voting, please refer the Notice of AGM. In case of any queries relating to remote e-voting you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no: 1800 1020 990 and 1800 22 44 30 or send a request to Mr. Amit Vishal, Senior Manager- NSDL at evoting@nsdl.co.in.

Members who need assistance before or during the AGM, can contact Mr. Amit Vishal, Senior Manager- NSDL at evoting@nsdl.co.in or call on toll free no: 1800 1020 990 and 1800 22 44 30.

Helpdesk for Individual Shareholders holding securities in demat mode for any technical issues related to login through Depository i.e. NSDL and CDSL.

Login type	Helpdesk details
Securities held with NSDL	Please contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30
Securities held with CDSL	Please contact CDSL helpdesk by sending a request at evoting@cdslindia.com or contact at 022- 23058738 or 022-23058542-43

The Annual Report including Notice of the AGM of the Company is available on the website of the Company at <https://mf.nipponindiaim.com>. The same can also be accessed from the websites of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of NSDL at www.evoting.nsdl.com.

For Nippon Life India Asset Management Limited
(formerly known as Reliance Nippon Life Asset Management Limited)
Nulifer Shekhawat
Company Secretary & Compliance Officer

Place : Mumbai
Date : May 28, 2021

પૂ. મોરારિબાપુનાં પરમ અનુગ્રહથી ચાલતા સાવરકુંડલામાં કોવિડ કેર સેન્ટરમાં વિનામૂલ્યે કોરોના દર્દીની સારવાર


વધુ વિગત માટે મો. ૯૮૯૮૯ ૪૩૩૯૯ પર સંપર્ક કરો

સાવરકુંડલા, તા. ૧૨

વંદનીય પૂ. મોરારિબાપુના પરમ અનુગ્રહથી સાવરકુંડલા શહેર અને તાલુકાના દરેક ગામમાં કોરોના સંક્રમણગ્રસ્ત નાગરિકોને શક્ય તેટલી મદદ કરવાનું કામ શ્રી વિદ્યાગૃહ ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યું છે.

તા. ૧ મે ૨૦૨૧થી સુધક કન્યા છાત્રાલય, સાવરકુંડલામાં કોવિડ કેર સેન્ટર દર્દીનારાયણની સેવામાં નિ:શુલ્ક પણે કાર્યરત છે. ત્યાં સંક્રમિત થયેલા લોકોની નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે. ગામમાં આ પ્રકારના કોઈ કેસ હોય તો તે દર્દીને કોવિડ કેર સેન્ટર પર પહોંચાડવાની વ્યવસ્થા કરાશે. પરંતુ દર્દીને ત્યાં લાવતા પહેલા આ ૯૮૯૮૯ ૪૩૩૯૯ નંબર પર ફોન કરી બેડ ઉપલબ્ધ છે કે નહીં અને ન હોય તો ક્યારે થશે. તેની જાણકારી મળી રહેશે.

સાવરકુંડલા શહેર અને તાલુકાના દરેક ગામમાં કોરોના સંક્રમણગ્રસ્ત નાગરિકોને શક્ય તેટલી મદદ થઈ શકે એ માટે સાવરકુંડલા વિસ્તાર અને સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે ૧૫,૦૦૦ માસ્કનું વિતરણ હોસ્પિટલ અને વિવિધ સેવાભાવી સંસ્થાની મદદથી કાર્ય પૂર્ણ કરેલ છે. જેમાં વિવિધ ૫૦ જેટલા સાવરકુંડલા તાલુકાનાં વિવિધ ગામડાઓમાં માસ્ક પહોંચાડીને સરપંચ ને ગામના



જરૂરિયાતમંદ વ્યક્તિઓને માસ્ક મળી રહે એ રીતે વિતરણ કરવા વિનંતી કરી છે. સંક્રમણથી બચવા હાલ માસ્ક જ આપણું હથિયાર છે. ફંડમાંથી મળેલી રકમમાંથી આ માસ્ક મોકલેલ છે. આ ઉપરાંત સંક્રમિત થયેલા દર્દીઓને કોઈ પણ પ્રકારની મેડિકલ મદદની જરૂર હોય તો ઉપરના નંબર પર સંપર્ક કરશો તો શક્ય તેટલી મદદ કરવામાં આવશે. પૂ.બાપુની સુચના અને તેમના પરમ સદભાવથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

જુના સાવર ખાતે શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું



સાવરકુંડલા, તા. ૧૨

જુના સાવર કન્યા શાળા ખાતે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેની તમામ વ્યવસ્થા સરપંચ કલ્પેશભાઈ લક્ષણો ધરાવતા દર્દીઓ જેઓ થોડા દિવસ પોતાના પરિવાર થી દુર રહે તો પરિવાર ને પણ સંક્રમણ થી બચાવી શકાય આ આશયથી ગ્રામપંચાયતના સહયોગથી કન્યા શાળા ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું જેની તમામ વ્યવસ્થા સરપંચ કલ્પેશભાઈ કાનાણી દ્વારા કરવામાં આવી અને શાળા કક્ષાએ આચાર્ય વિપુલભાઈ દુધાત દ્વારા જરૂરી સહકાર આપવામાં આવ્યો.

સુરત સ્થિત ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી દ્વારા સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેવામાં આવી

ડો. શર્મા, ડો. કાછડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા

સાવરકુંડલા, તા. ૧૨

સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિ:શુલ્ક કરાયેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા સુરતના મહેશભાઈ સવાણી ગ્રુપ તથા તેમની સાથે એમ.ડી. ડોક્ટર પ્રતીક સાવજ તેમજ ડોક્ટર નંદીશ મશરૂ સાથે અન્ય ડોક્ટર ટીમ દ્વારા સાવરકુંડલા લલ્લુભાઈ શેઠ સંચાલિત ચાલતું નિ:શુલ્ક કોવીડ સેન્ટરના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરવામાં આવેલ.

આ પ્રસંગે સાવરકુંડલાના ઉદ્યોગપતિ અને સેવાભાવી કરશનભાઈ ડોબરિયા તેમના સાથી મિત્ર અને સેવાભાવી દેવચંદભાઈ કપોપરા, હીનાવલી વાળા તેમજ ડોક્ટર



અરવિંદ શર્મા એમ.ડી. કિર્તિશિયન ડોક્ટર સાગર કાછડીયા, એમ.ડી. કિર્તિશિયન સાથે લલ્લુભાઈ આરોગ્ય મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ જોશી તથા રાજુભાઈ બોરીસાગર ડાહર રહ્યા હતા.

સાવરકુંડલા અને અમરેલીમાં સ્વાસ્થ્ય સુરક્ષા કાષ્ટે છેડાયું એક અનોખું અભિયાન : ભાગ કોરોના ભાગ

સાવરકુંડલા, તા. ૧૨

લોકોને પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડું સાવધ રહેવા માટે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત કરવી પડે એવી વેળાએ સાવરકુંડલા અને અમરેલીમાં લોકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે એક અનોખું અભિયાન છેડાયું છે.

આ સંદર્ભે તાત્કાલિક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને Indian2PAY Servicesના આર્થિક સહયોગ દ્વારા આ શહેરોમાં મોસંભીનું વેચાણ નુકસાની ભોગવીને કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત ગળો (ગિલોય) જેને આયુર્વેદમાં અમૃતા પણ કહીએ છીએ તેનું નિ:શુલ્ક વેચાણ તથા જેની હજુ સુધી લોકોને સમજ પડે ન હતી તે પ્રાણવાયુ માપવાનું સાધન ઓક્સિમીટરનું વેચાણ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે



સાવરકુંડલા મહુવા રોડ સ્થિત આવેલા રાધિકા માવા સેન્ટર મનોજ મેડિકલની બાજુની ગલીમાં દરરોજ સવારે ૧૦ થી સાંજના ૬ સુધી વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ઈંગોરાળાથી ધારી વચ્ચેનાં માર્ગનાં કાર્યનો પ્રારંભ કરતા ધારાસભ્ય જે.વી. કાકડીયા

માર્ગ પરના ગામજનોમાં હરખનો માહોલ



અમરેલી, તા. ૧૨

ઈંગોરાળા-ધારી વચ્ચેના બિસ્માર માર્ગનું નવિનીકરણ કરવાનો પ્રારંભ ધારાસભ્ય જે.વી. કાકડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, જિલ્લા પંચાયતના સદસ્ય કાળુભાઈ ડિંડોળીયા, ભાજપના પ્રમુખ જીતુભાઈ જોશી, કાંતિલાલ તંતી, અતુલ કાનાણી, ખોડાભાઈ ભુવ, અનીલ તંતી તથા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કોરોનાથી ભયવા પ્રકૃતિ તરફ પાછા વળો

છેલ્લા વીસેક દિવસથી હોસ્પિટલમાં અરડુસીના પાન, ગળો અને તુલસીના પાન લેવા આનારની સંખ્યા ખૂબ વધી ગઈ છે. અત્યાર સુધી આ અમૂલ્ય ઔષધિઓ તરફ અમારું ધ્યાન કેન્દ્રીત નહોતું થયું પણ અત્યારે આ ઔષધિઓ સાવ સુકાઈ ગઈ ત્યારે તેની કિંમત સમજાય છે.

મિત્રો દર વર્ષે ચૈત્ર મહિનો શરૂ થતા પહેલાં અને લીમડાનો કોલ પીવાની લોકોને સલાહ આપતા હોઈએ છીએ પણ આ વર્ષે કયાંય લીમડાના કોલ દેખાણ જ નહીં આવું કેમ થયું ? કયાંક પ્રકૃતિનો પ્રકોપ તો નથી ને ? એવું કેમ થયું હશે ? આવી કોઈપણ નવી કે અજુગતી બાબત જ્યારે મને ધ્યાનમાં આવે હું ચરક સંહિતામાં તેનો જવાબ શોધવાનો પ્રયત્ન કરું છું અને આજ સુધીમાં એવું ક્યારેય બન્યું નથી કે ચરકસંહિતામાંથી જવાબ ન મળ્યો હોય કારણ આયુર્વેદ માત્ર ચિકિત્સા શાસ્ત્ર નથી પરંતુ જીવનની દરેક મુશ્કેલીનો જવાબ આપતું જીવનશાસ્ત્ર છે. ચરક સંહિતાના વિમાન સ્થાનના અધ્યાય ૩ માં જેનું વિસ્તાર પૂર્વક વર્ણન છે તે જનપદોદ્ધવશ વ્યાધીમાં પૂર્વરૂપ (રોગ થયા પહેલાના લક્ષણ)માં આવો ઉલ્લેખ જોવા મળ્યો. હે સોમ્ય, અસ્વાભાવિક સ્થિતિમાં રહેલા નક્ષત્ર, ગ્રહસમૂહ, ચંદ્ર, સૂર્ય, વાયુ, અગ્નિ અને દિશાઓના ઋતુ વિકાર કરનારા ભાવો અવશ્ય જોવામાં આવે છે હવે પૃથ્વી પણ શીઘ્ર ઔષધિના રસ, વીર્ય, વિપાક અને પ્રભાવ જોઈએ તેવા ઉત્પન્ન કરશે નહીં. ઔષધિઓમાં રસ, વીર્યાદીના અભાવથી રોગ થવો નિશ્ચિત છે. તેથી હે સોમ્ય ! વિનાશ થયા પહેલા અને ભૂમિ વિરસ થતા પહેલા જ્યાં સુધીમાં ઔષધો, રસ, વીર્ય, વિપાક અને પ્રભાવમાં હિન ન થાય ત્યાં સુધીમાં ઔષધિઓનો સંગ્રહ કરી લો જેઓ આપણને ચાહે છે તથા આપણે જેને ચાહીએ છીએ તે બધામાં ઔષધિઓના રસ, વીર્ય, વીપાક અને પ્રભાવનો ઉપયોગ કરીશું. આનો અર્થ એ છે કે જ્યારે પણ આવી ઔષધિઓ તેનો ગુણ ગુમાવે છે ત્યારબાદ આવા જનદોદ્ધવશ થવા નિશ્ચિત છે.

તો શું કોરોના થવાનું કારણ પ્રકૃતિનો વિનાશ છે ? આ માટે આપણે આયુર્વેદમાં વર્ણન જનપદોદ્ધવશ વ્યાધીને આજના સમય મુજબ સમજાવે. દરેક મનુષ્યની પ્રકૃતિ, જાતી, ઉંમર અલગ-અલગ હોવા છતાં બધાને એકસાથે જ કેમ એકસરખો રોગ થાય છે ? આ પ્રશ્નના જવાબમાં આયુર્વેદમાં કહેલ છે કે ભલે દરેક મનુષ્યની પ્રકૃતિ, ઉંમર,

જાતી અલગ-અલગ હોય પણ દરેક મનુષ્યના વાયુ, જલ, દેશ અને કાલ સમાન હોવાથી જ્યારે આ ચાર બાબત પ્રકૃતિ (પ્રદૂષિત) થાય ત્યારે સમગ્ર જનસમૂહમાં એકસાથે એકસરખો રોગ ફેલાય છે. આયુર્વેદમાં જનપદોદ્ધવશ (પેન્ડેમીક) થવાનું કારણ પ્રજાપરાધ (ખતાવેલ છે. અને આ પ્રજાપરાધ થવાનું કારણ અધર્મ ખતાવેલ છે. અધર્મ એટલે આપણે જે ધર્મ સમજીએ છીએ તે નહીં પણ પ્રકૃતિ વિરુદ્ધનું વર્તન એટલે અધર્મ. પ્રગતિના નામે આપણે જળ, સ્થળ, નભને પ્રદૂષિત કરતા રહીએ છીએ. ધી, ધૃતિ અને સ્મૃતિથી ભ્રષ્ટ થઈને મનુષ્યો અશુભ (ન કરવાના કામ) કાર્ય કરે છે તેને જ પ્રજાપરાધ કહે છે. પ્રજા એટલે શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિથી જાણી જોઈને કરેલો અપરાધ એટલે પ્રજાપરાધ. તાત્વિક રીતે કહીએ તો ખોટી અને ભેદભાવ યુક્ત વિચારણા, રાગદેપ પૂર્વકની વિચારણા, પરમતત્ત્વ દ્વારા માણસને ન્યાયપૂર્વક વિચારવા માટે બુદ્ધિ આપી છે. પરંતુ માનવીને લાગણી એટલે રાગ પણ ઉદભવે છે અને દેષ એટલે બીજા વિશે પક્ષપાત પણ થાય છે. આ રાગદેપથી માનવપર ના થાય તોમાનવ જન્મે એળે ગયો કહેવાય. ન્યાયપૂર્વક વર્તવાને બદલે સમત્વ રાખવાને બદલે પક્ષપાત રાખવામાં આવે, કોરોના વાયરસ મનુષ્ય જાતીને એક અગત્યનો પાઠ ભણાવવાનો છે. માણસે પાછલી એક સદીમાં એટલી સમૃદ્ધિ મેળવી છે કે પ્રકૃતિ કે બીજા જીવ (મનુષ્ય સિવાયના બીજા જીવ) ઉપરની તેની નિર્ભરતા સાવ ઓછી થઈ ગઈ છે. માણસ એટલો સક્ષમ છે કે તેને બીજાની કોઈ પડી નથી અને બીજાને તેના ઉપભોગથી વિશેષ ગણતો નથી. પરંતુ કોરોના વાયરસ પહેલીવાર માણસને એ વાતનું ભાન કરાવશે કે હું નહીં, બીજો માણસ સ્વસ્થ રહે તેમાં મારી સ્વસ્થતા અને સલામતી છે.

આ પૃથ્વી ઉપર ફક્ત માણસ જ નહીં પરંતુ દરેક જીવમાત્રને જીવવાનો પૂરતો અધિકાર છે. આ પૃથ્વી ઉપરનો દરેક જીવ પૃથ્વીનું સંતુલન જાળવવા માટે નાનો-મોટો ફાળો આપે છે. જેમકે આપણે એ જાણી શક્યા છીએ કે વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડને શોષી વાતાવરણને શુદ્ધ ઓક્સિજન પૂરો પાડે છે અને વરસાદ તથા પ્રકૃતિના સંતુલન માટે વનસ્પતિ ખૂબ જરૂરી છે. આવું જ એવા કેટલાય સૂક્ષ્મ જીવો જે વાતાવરણનું સંતુલન જાળવવા મદદરૂપ થાય છે. પરંતુ મનુષ્યજાતી પ્રજાપરાધને કારણે આવી કેટલીય સૂક્ષ્મ જીવોનું અસ્તિત્વ જ મીટાવી દીધું છે. જેના પરિણામે આવા કોરોના જેવા વાયરસ તેનું માથું ઉંચકી રહ્યા છે.

તોરી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ડીડીઓ



વડિયા, તા. ૧૨

અમરેલીના છેવાડાના વિસ્તાર એવા વડિયા અને તેના ગ્રામીણ કહે છે કે માનવી જેમ જેમ જંગલો પર કબજો કરે છે તેમ તેમ જંગલોમાં રહેનારા વાયરસ, બેક્ટેરીયા અને પેથોજોન્સ માનવો પર આક્રમણ કરીને સંક્રમણ ફેલાવે છે. ચીનમાં પણ આવું જ થયું હતું. ચીનમાંથી જે વાયરસ નીકળ્યો તેને મિડલ ઈસ્ટ સિન્ડ્રોમ કહેવાયો હતો. ત્યાંથી જ સાર્સ ફેલાયો હતો અને હવે કોરોના પણ ત્યાંથી જ ફેલાયો છે.

આજે પણ આવા એકપણ વાયરસનું ઉત્પત્તિસ્થાન ભારત રહ્યું નથી કારણ આપણે વસુવેકુલુમ્બકમ (આખી પૃથ્વી માડું કુટુંબ છે)ની સંસ્કૃતિમાં માનીએ છીએ. અરે માણસ જ નહીં જીવ માત્રમાં દયાભાવ અને તેનું અસ્તિત્વ ટકી રહે તેવા પ્રયત્ન કરીએ છીએ, તુલસી ક્યારે આપણે સવાર-સાંજ થી નો દીવો એટલે જ કરીએ છીએ કે વાતાવરણમાં એવા કેટલાય સૂક્ષ્મ જીવોના અસ્તિત્વ માટે થી ના દીવામાંથી નીકળતી ધુમ્રસર આ જીવનું પોષણ કરે છે. કીડી જેવા જીવનું પણ મહત્વ સમજી કિડિયાડ પુરનારો આ દેશ આવી વિકટ પરિસ્થિતિમાં મુંઝાય નહીં. પણ ક્યાં સુધી આવા કહેવાતા વિકાસશીલ અને અપ્રાકૃત રીતે જીવનારા દેશો (ચીન)નો ભોગ આપણે બનતા રહીશું ? આનાથી બચવું હશે તો આપણે આપણે પ્રાકૃતિક વારસો સાચવવો જ પડશે અને ફરી પાછા પ્રકૃતિ તરફ વળવું પડશે.

‘હેયા બાળવા કરતા હાથ બાળવા સારા’ સાવરકુંડલામાં વેપારીઓએ ધૂળની સમસ્યાથી છુટકારો મેળવવા પાણીનો છંટકાવ કર્યો વેપારીઓની અવગણના તંત્ર દ્વારા કરાઈ



સાવરકુંડલા, તા. ૧૨

સાવરકુંડલામાં આવેલ મેઈન બજારમાં નવા રોડનું કામકાજ શરૂ હોય ઉપર ધૂળ નાખવામાં આવી તેના કારણે વેપારીઓ સતત પ દિવસથી ધૂળનો ભયંકર રીતે સામનો કરી રહ્યા છે. સત્તાધીશોને વારંવાર વિનંતી કરવામાં આવી પરંતુ પાણી છાંટવામાં આવ્યું ન હતું. છેવટે વેપારીઓએ પોતાના સ્વખર્ચે પાણીનો બમ્બો મંગાવીને પાણી છંટકાવ કરી રોડ સાફ કર્યો હતો.

હેપ્પી બર્થ-ડે...

‘કરણસિંહ’ નો આજે જન્મદિવસ હોવાથી પપ્પા : ભિમલસિંહ સોલંકી, કાકા : ગંભીરસિંહ, ભાઈ : રાજકુંવરસિંહ, જયદેવસિંહ તેમજ સમગ્ર સોલંકી પરિવાર તરફથી લાડકડા ‘કરણસિંહે’ તેના જન્મદિવસે ખુબ-ખુબ શુભકામનાઓ : મુ. બાબરા : કરણસિંહ સોલંકી

‘કરણસિંહ’ નો આજે જન્મદિવસ હોવાથી પપ્પા : ભિમલસિંહ સોલંકી, કાકા : ગંભીરસિંહ, ભાઈ : રાજકુંવરસિંહ, જયદેવસિંહ તેમજ સમગ્ર સોલંકી પરિવાર તરફથી લાડકડા ‘કરણસિંહે’ તેના જન્મદિવસે ખુબ-ખુબ શુભકામનાઓ : મુ. બાબરા : કરણસિંહ સોલંકી

APM TERMINALS Lifting Global Trade.

ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ: પિપાવાવ પોર્ટ, મુકામ પોસ્ટ રામપરા-૨, વાયા રાજુલા જિલ્લો અમરેલી ગુજરાત ૩૬૫૬૬૦
CIN: L63010GJ1992PLC018106
ટેલીફોન: 02794 302400 ફેક્સ: 02794302413
વેબસાઈટ: www.pipavav.com
ઈમેલ: investorrelationinppv@apmterminals.com

સેબી (લિસ્ટિંગની જવાબદારી અને જાહેરાતની જરૂરિયાતો) નિયમન, 2015નાં નિયમ 47ની સાથે નિયમ 29 મુજબ, અહીં નોટિસ આપવામાં આવે છે કે ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ (‘કંપની’)નાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક ગુઢવાર, 27 મે, 2021નાં રોજ યોજાશે, જેમાં 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે ઓડિટ થયેલા સ્વતંત્ર અને કુલ નાણાકીય પરિણામોનો વિચાર કરવામાં આવશે તેમજ 31 માર્ચ, 2021ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે ઈકિવટી શેર મૂડી પર ફાઈનલ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવશે, જે એની સાધારણ વાર્ષિક સભામાં કંપનીના સભ્યો દ્વારા મંજૂરીને આધિન છે.

બેઠકની વિગતો કંપનીની વેબસાઈટ www.pipavav.com તથા સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ www.bseindia.com અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

તારીખ : 12 મે, 2021
સ્થળ : મુંબઈ

ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ માટે
મનિષ અગિનહોત્રી
કંપની સેક્રેટરી

